



Date: 29th August, 2025

BSE Limited

Dept. of Corporate Services, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001 BSE Scrip Code - 541304

National Stock Exchange of India Limited

Dept. of Corporate Compliances, Exchange Plaza, C-1 Block-G, Bandra Kurla Complex, Bandra (E) Mumbai- 400 051 NSE Symbol: INDOUS

Subject: Newspaper Advertisement for the Notice of 21st Annual General Meeting of the Company.

Dear Sir,

Please find enclosed herewith a copy of each newspaper clipping of the advertisement published in Western Times (English) and Western Times (Gujarati) on Friday, 29.08.2025, in accordance with the General Circular No. 09/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs (MCA) and circular issued by SEBI vide circular no. SEBI/ HO/ CFD/ CFDPoD-2/ P/ CIR/ 2024/ 133 dated October 3, 2024 ("SEBI Circular"), inter-alia, intimating that the 21st Annual General Meeting of the Company will be held on Tuesday, 30th September, 2025 at 02:30 p.m. through VC / OAVM facility.

Kindly take the above information on your record.

Thanking You,

Yours faithfully,

For, Indo Us Bio Tech Limited

DIMPY DIVYANGBHAI JOSHI Digitally signed by DIMPY DIVYANGBHAI JOSHI Date: 2025.08.29 09:33:08 +05'30'

Ms. Dimpy Joshi

Company Secretary & Compliance officer



Sprite Brings A Zesty Twist With New Tvc 'spicy Ko De Sprite Ka Tadka'

iconic lemon and lime-flavored beverage, has unveiled a new mealtime ritual with the launch of its latest campaign, Spicy ko de Sprite ka Tadka, a brand idea inspired by India's enduring love for spice. Built around a fizzy spice-Sprite-spice loop, the campaign positions Sprite as a perfect partner to spicy food, enhancing the consumer experience by cutting through heat and unlocking more flavor in every bite.

Sumeli Chatterjee, Vice President – Market-ing, Coca-Cola India & Southwest Asia, said, "India's love for spicy food runs deep, but what's remained largely untapped is to pair it with the right kind of beverage. That's where Sprite naturally

New Delhi, Sprite, the steps in. The crisp, lemonlime twist doesn't just cool you down, it elevates the whole spicy food experience. With 'Spicy ko de Sprite ka Tadka', we are tapping into this fun pairing and creating a new space for Sprite, beginning a long-term connection we believe will resonate deeply with the Gen Zs.

Sharvari added, "Sprite has nailed it yet again with the 'Spicy ko de Sprite ka Tadka' campaign that is fun and relatable. What I really love is how Sprite always comes up with clutter-breaking campaigns that feel fresh and exciting every single time. As a brand, Sprite always aims to connect with Gen Zs and this Ad film is another perfect example of that. The whole idea of pairing spicy food with Sprite makes the taste even better. I can't wait for everyone to try this combination already

Sunil Grover shared, "For me, a great meal is all about the experience, and this campaign really gets that. I can't say no to spicy food and pairing it with Sprite just feels right. Shooting the ad was so much fun and love how Sprite has spiced it up, literally." "India's love affair with spice is legendary, and for Gen Z, it's a badge of honour" said Sukesh Nayak, Chief Creative Of-ficer, Ogilvy India. "We saw an incredible opportunity to connect with that passion in a completely new way. 'Spicy ko de Sprite ka Tadka isn't just a campaign, it's an invitation to embrace the thrill of spice like never before.'

Abril Paper Tech planning to raise up to Rs. 13.42 cr from public issue trat, Surat based, IPO, Mr. Prince Lathiya, Rs 2.01 crores will be

tion paper coating & slitting

machines. Rs. 5.00 crores

ing capital requirements.

areas and reach tier-2 and tier-3 markets more deep-

ly. The macro tailwinds are

évident: lower borrowing

costs due to repo rate cuts,

an increase in the tax-free

income limit to Rs 12 lakh.

will be used to meet work-

Abril Paper Tech Ltd, a leading manufacturer and supplier of sublimation heat transfer paper, is planning to raise up to Rs. 13.42 crore from its SME public issue.

The company has received approval to launch its public issue on SME Platform of Bombay Stock Exchange. The public issue opens for subscription on August 29, 2025 and closes on September 02, 2025. Interactive Financial Services Ltd. is the book running lead manager of the issue.

Founded and promoted by Prince Lathiya, Vipul Dobaria, and Ashishvin Lathiya, the company brings over eight years of industry expertise in sublimation and heat transfer paper solutions.

Commenting on the

commerce are changing

the way that consumers

shop. According to Red-

seer, when combined, they

should increase festive par-

ticipation outside of metro

Non-Executive Director, for general corporate pur-Abril Paper Tech Ltd, said, poses whereas Rs 1.01 "This IPO marks an imcrore will be used towards portant milestone in our IPO expenses. growth journey. We have built a strong foundation The initial public offering of Rs. 13.42 crore, in the sublimation and

comprises of a fresh issue heat transfer paper indusof 22,00,000 shares of face try, and the fresh funds value Rs. 10 each. Comwill enable us to expand pany has fixed price of Rs. capacity, upgrade tech-61 per equity share for the nology, and strengthen public issue. 1,12,000 our market presence. Our shares are reserved for vision is to position Abril Market Makers and as a trusted name in high-20,88,000 shares are for public offering. The lot size is 2000 and lot size for requality printing solutions and to deliver consistent value to our stakeholdtail investors is 2 lots (4000 shares) amounting to investment of Rs 2,44,000. The issue aims to raise funds for multiple objec-The minimum lot size investment for HNI is 3 lots tives. Rs 5.40 crores will be utilized towards additional (6000 shares) amounting to Rs.3,66,000. Sharehold-2 fully automatic sublima-

ing post issue will be

79,81,840 shares, which

as of now is 57,81,840

September 23, 2025.

login details for e-voting.

Place: Ahmedabad

Place: Ahmedabad

Date: 28th August, 2025

Date: 28th August, 2025

GST simplification to lower goods'

prices, ease inflation pressure: Report

New Delhi, Aug 28 (IANS) The government's plan to simplify the GST structure, replacing the existing four-slab GST system with a simpler two-slab structure, is set to bring considerable relief to the consumers, with lower tax rates expected to make a wide range of goods more affordable, according to a new report. This move will directly benefit 11.4 per cent of India's PFCE, with taxable consumption estimated at Rs 150-160 lakh crore, BoB said in its analysis.

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI [Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 266 of the Companies Act, 2013 application has been paid to the

366 of the Companies Act, 2013, an application has been made to the Registrar of Companies, Gujarat and/or Registrar of Companies, Central Registration Centre, Gurgaon that M/s. SHASHWAT LAVISH LLP a LLP may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares in the name of the M/s. SHASHWAT LAVISH PRIVATE LIMITED (Proposed Name).

2. The principal objects of the company are to carry on the business of Operation of sand or gravel pits, basalt/ porphyry, clay (ordinary), crushing and breaking of stone for use as a flux or raw material in lime or cement, manufacture or as building material, road metal or ballast and other materials for construction.

3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at 3-19-15, Dadu Ne

Khadki, Visnagar, Mahesana, Gujarat - 384315.

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to Registrar of Companies, Central Registration Centre, Ministry of Corporate Affairs, IICA, Plot no. 6,7,8, Sector 5, IMT Manesar, Gurgaon-122050, Haryana, India, or/and Registrar of companies Gujarat at ROC Bhawan, Opp. Rupal Park, Near Ankur Bus Stand, Naranpura, Ahmedabad-380013, Gujarat, India within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Date: 29.08.2025 FOR SHASHWAT LAVISH LLP

Date: 29.08.2025

set out in the Notice of AGM which is being circulated for convening the AGM.

Indo Us Bio-Tech Limited

(CIN: L01122GJ2004PLC043550)

Regd. Office: 309, Shanti Mall, Satadhar Char Rasta, Opp. Navrang Tower,

Sola Road, Ahmedabad – 380061, Gujarat Phone No.: 079 27491807

Email ID: indouscs@gmail.com Website: https://www.indousagriseeds.com/

Notice to the Shareholders of 21st Annual General Meeting

NOTICE IS HEREBY GIVEN THAT THE 21ST ANNUAL GENERAL MEETING (AGM) of the

members of the Company will be held on Tuesday, 30th September, 2025 at 02:30 PM through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as

Pursuant to the Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13

2020 issued by The Ministry of Corporate Affairs ("MCA") has vide its circular dated May 5, 2020 read together with circulars dated April 8, 2020; April 13, 2020; January 13, 2021; December 14, 2021 and December 28, 2022 (collectively referred to as "MCA Circulars"), with the

General Circular No. 09/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs (MCA) and circular issued by SEBI vide circular no. SEBI/ HO/ CFD/ CFDPoD-2/ P/

CIR/ 2024/ 133 dated October 3, 2024 ("SEBI Circular") permitted convening the Annual General Meeting ("AGM" / "Meeting") through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), without the physical presence of the members at a common venue. In ac-

cordance with the MCA Circulars, provisions of the Companies Act, 2013 ('the Act') and the

Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the AGM of the Company is being held through

In accordance with the aforesaid circulars, Notice of the AGM along with Annual Report 2024-

2025 is being sent only by electronic mode to those members whose Email addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report of 2024-2025 made available on Company's website: https://

www.indousagriseeds.com/, website of Stock Exchange i.e. BSE Limited at

www.bseindia.com NSE Limited at www.nseindia.com and AGM Notice will also be made available on website of NSDL (agency for providing remote e-voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and Participate in the AGM through VC/OAVM

facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013. The remote e-voting facility shall commence on September 27, 2025 at 9.00 a.m. (IST) and

ends on September 29, 2025 at 5.00 p.m. (IST). A person whose name appears in the register of members / beneficial owners as on the cut-off date i.e. September 23, 2025 shall be entitled

to avail facility of remote e-voting as well as voting at the meeting. Any person who becomes member of the Company after dispatch of the Notice and holding shares on the cut-off date i.e.

The Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast

their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is

providing the facility voting through e-voting system during the AGM (e-voting) detailed procedure for remote e-voting is provided in the Notice of AGM. In case members have not registered their email addresses with the Company/Depository, please follow the below instructions to register email address for obtaining Annual Report and

like Folio No., Name of Shareholder by email to indouscs@gmail.com

For members holding shares in physical mode - Please provide necessary details

Members holding shares in demat mode can get their email ID registered by contacting their respective depository participant or by email to indouscs@gmail.com. The 21 $^{
m st}$ AGM Notice will be sent to the shareholders holding shares as on benpos date for the dispatch in accordance with the applicable laws on their registered email addresses in due In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked

For, Indo Us Bio Tech Limited

Chairman & Managing Director (DIN-01745951)

SD/- Jagdish Ajudia

Prince Patel Designated Partner

India's e-commerce industry to generate Rs 1.15 lakh crore GMV this festive season day season and another merce, these two types of

after Diwali, when the full

reaching 150 per cent for

quick commerce and 30 to

35 per cent for value com-

With pre-festive growth

impact of the GST is felt.

New Delhi, Aug 28 (IANS) India's e-commerce industry, which is expected to grow by 20-25 per cent annually which is nearly double the pace of the previous year, is expected to generate over Rs 1.15 lakh crore in gross merchandise value (ĞMV) this festive season, a report has said.

Repo rate cuts, increased disposable income, growing rural affluence, and pent-up demand across categories like fashion, home goods, and ap-

Date: 29.08.2025 Place: Baroda

pliances are all helping India's festive economy prepare for its most successful run this year, according to a report by Redseer Strategy Consultants.

Redseer predicts that India's e-commerce industry, which will be the biggest beneficiary this festive season, will close 2025 with 17-22 per cent growth, the highest in three years,

thanks to festive tailwinds. Businesses must prepare for "dual peaks" in demand, one during the holi-

S/d Authorised Officer For ICICI Bank Limited

PUBLIC NOTICE

Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex Mumbai 400051 GOLD E-AUCTION CUM INVITATION NOTICE

GOLD E-AUCTION CUM INVITATION NOTICE

The below mentioned borrowers have been issued notice to pay off their outstanding amount towards the facility against gold ornaments, ("Facility") availed by them from ICICI Bank Limited ("ICICI Bank"). We are constrained to conduct an E-Auction of pledged gold ornaments on September 08, 2025 as they have failed to repay the dues. ICICI Bank has the authority to remove account /change the E-Auction date without any prior notice. Auction will be held online-https://gold.samil.in between 12:30 pm to 3:30 pm. For detailed Terms and conditions, please log into given website. In case of deceased borrower, all conditions will be applicable to legal heirs.

Loan A/C No. Customer Name

036005017410 Himanshu Panchal

Branch Name: Bangalore - Electronic City PH-I

TIRTH PLASTIC LIMITED

Regd. Office: 602, 6th FLOOR, ONE WORLD WEST,S.NO. 396,F.P.119 NR VAKIL BRIDGE, BOPAL, AMBLI ROAD, VILLAGE VEJALPUR, AHMEDABAD GJ 380051 II

NOTICE OF THE 39th ANNUAL GENERAL MEETING,

REMOTE E-VOTING INFORMATION, INFORMATION FO

VC/OAVM AND BOOK CLOSURE DATES

MOTE E-VOTING INFORMATION, INFORMATION FO VC/OAVM AND BOOK CLOSURE DATES

Notice is hereby given that the 39th Annual General Meeting (AGM) of the company will be held on Tuesday, 23rd September, 2025 at 12.00 P.M through Video Conference (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with provisions of Companies Act, 2013 and the rules made thereunder and the SEBI(LODR) Regulation, 2015 No. 14/2020 dated 8th April 2020, Circular No. 17/2020 dated 13th April 2020, Circular No. 17/2020 dated 13th April 2020, Circular No. 20/2020 dated 5th May 2020 and Circular No. 10/2022 dated 28th December 2022 (collectively referred to as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars") permitted the holding of an Annual General Meeting ("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), and other circulars issued by Ministry of Corporate Affairs , Government of India and SEBI, to transact the businesses that will be set forth in the Notice of the Meeting. The aforesaid Notice and the Annual Report of the company for the year ended 31st March, 2025 will be sent in electronic mode to all the members whose e-mail ids are registered with the Company / Depository Participants. The Notice of the AGM and the Annual Report will also be available and can be downloaded from the website of the Company i.e. https://www.tirthlimited.in/Annual%20Reports/2024-25/Annual%20Report%20Tirth.pdf and on the website of the Bombay Stock Exchange i.e. www.bseindia.com.

Process for those shareholders whose email ids are not registered with the depositories for procuring user id and password and registration of e mail ids for e-voting for the resolutions set out in this notice

In case shares are held in physical mode please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) by email to (tirthplastic@gmail.com). In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) to (tirthplastic@gmail.com). If you are an Individual shareholders holding securities in demat mode, you are requested to refer to the login method explained at step 1 (A) i.e. Login method for e-Voting and joining virtual meeting for Individual shareholders holding securities in demat mode.

Alternatively shareholder/members may send a request

meeting for Individual shareholders holding securities in demat mode.

Alternatively shareholder/members may send a request to evoting@nsdl.co. in for procuring user id and password for e-voting by providing above mentioned documents. Pursuant to section 91 of the companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer books of the company shall remain closed from 17th September, 2025 to 23rd September, 2025 (both days inclusive) for the purpose of the AGM to be held on Tuesday, 23rd September, 2025.

The company is pleased to provide all its members (holding shares both in physical and in electronic form) the facility to exercise their vote through remote e-voting to be provided by National Securities Depository Limited (NSDL). Members of the company holding shares in physical or dematerialised from as on cut-off date i.e. 16th September, 2025 may cast their votes through remote e-voting. The remote e-voting shall commence on Saturday, 20th September, 2025 at 5:00 P.M.

The Board of Directors has appointed M/s. A SHAH & ASOCIATES, Practicing Company Secretaries (FCS-4713/CP NO-6560) as Scrutinizer to scrutinize the remote E-voting process voting at the AGM in fair and transparent manner. The members attending the meeting who have not casted their vote by remote e-voting prior to the meeting who have not casted their votes by remote e-voting prior to the meeting may attend the meeting but shall not be entitled to cast their vote again. The cut-off date (i.e. record date) for the purpose of remote e-voting is 16th September, 2025.

Only those members who have registered themselves as a

(i.e. record date) for the purpose of remote e-voting is 16th September, 2025.

Only those members who have registered themselves as a speaker before 7 days of AGM will be allowed to express their views/ask questions during the AGM.

Any person who acquires shares of the company and becomes member of the company after the despatch of the Notice and holding shares as of the "cut-off date" i.e. 16th September, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if the member is already registered with NSDL for remote e-voting then the existing user ID and password can be used for remote e-voting. For the process and manner of remote e-voting, members may go through the remote e-voting instructions sent via e-mail to the members whose e-mail IDS are registered with the Company / Depository Participant and physical copy sent to the other members or visit NSDL'S website. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to KETANKUMAR PATEL at evoting@nsdl.co.in

and 1800 22 44 30 or se at evoting@nsdl.co.in

Place : Ahmedabad

Date

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007

WESTERN RAILWAY TO RUN FESTIVAL SPECIAL TRAIN BETWEEN ASARVA 💳 KANPUR CENTRAL

TRAIN NO.	ORIGINATING STATION & DESTINATION	DATES OF SERVICE	DEPARTURE	ARRIVAL
01906	ASARVA - KANPUR CENTRAL	23/09/2025 to 04/11/2025	09:15 Hrs (Tuesday)	07:00 Hrs (Next Day)
01905	KANPUR CENTRAL – ASARVA	22/09/2025 to 03/11/2025	08:15 Hrs (Monday)	05:45 Hrs (Next Day)

Halts: Himmat Nagar, Dungarpur, Zawar, Udaipur City, Mavli, Chanderia, Mandalgarh, Bundi, Keshorai Patan, Sawai Madhopur, Gangapur City, Bayana, Fatehpur Sikari, Idgah, Tundla, Firozabad and Etawah stations in both directions.

Composition: AC 2-Tier, AC 3-Tier, Sleeper Class and General Second Class Coaches.

For detailed information regarding timings of halts and composition, passengers may please visit www.enquiry.indianrail.gov.in.

The booking for Train No. 01906 will open from 30/08/2025 at all PRS Counters and on IRCTC website. The above train will run



WESTERN RAILWAY wr.indianrailways.gov.in

Like us on: facebook.com/WesternRly Follow us on: X x.com/WesternRly instagram.com/WesternRly

as Special Train on Special Fare.

PLEASE CARRY ORIGINAL ID PROOF FOR ALL RESERVED TICKETS

PUBLIC NOTICE

AICICI Bank Corpo

Date : 29 08 2025 Place : Ahmedabad, Morbi, Vadodara, Surat, Botad, Mahesana, Rajkot, Sabarkantha, Anand, Banas Kantha, Devbhumi Dwarka, Amreli, Bhavnagar, Kheda, Narmada, Panch Mahals, Patan

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390007 Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex Mumbai 400051 GOLD E-AUCTION CUM INVITATION NOTICE

The below mentioned borrowers have been issued notice to pay off their outstanding amount towards the facility against gold ornaments. ("Facility") availed by them from ICICI Bank Limited ("ICICI Bank"). We are constrained to conduct an E-Auction of pledged gold ornaments on September 08, 2025 as they have failed to repay the dues. ICICI Bank has the authority to remove account /change the E-Auction date without any prior notice. Auction will be held online-https://jewel-auction.procuretiger.com between 12:30 pm to 3:30 pm. For detailed Terms and conditions, please log into given website. In case of deceased borrower, all conditions will be applicable to legal heirs.

Loan A/C No.	Customer Name	Loan A/C No.	Customer Name	Loan A/C No.	Customer Name	
Branch Name: Amreli		048662010528	Sarsiya Kanuben Iavantilal	183162014592	Niravbhai Rajendrabhai	
072562011782	Talaviya Pradip Madhubhai	Branch N	Branch Name: Halol		Vora	
		177062001507	Soni	Branch Name	: Morvi, Gujarat	
	ame: Anand		Rajendrakumar	362457000005	Nishant Rasiklal	
025662005247	Parmar	Branch Name: Jasdan			Makawana	
	Ketandrasigh Gulabsinh		Vallabhbhai Gabhrubhai Al		: Rajkot-Astron owk	
Branch No	ame: Bapod	Branch Name: Kadi		331105001045	Hitesh Valabhai	
763262001114	Jadav Satishbhai	044262011227			Sambad	
Branch Name: Bardoli			Yusufkhan Baloch	Branch Na	me: Rajpipla	
045962010066	Varu Jack	B		137757000107	National Agro	
Anilbhai		Branch Name: Kadodara, Gujarat 347857000010 Abhishek Kumar		Branch Nai	Branch Name: Siddhpur	
Branch Name: Botad		347857000010	Singh	183457000121		
137562043925		Branch No	ame: Kheda		Hinchitbhai Rakeshkumar	
	Manjibhai Kaliya	202057000071	Pradeep Chawda	B b. b.l	: Surat-Udhana	
Branch No	ame: Deesa	Branch Na	me: Lakhani			
049762020885		761162001032	Pravinbhai Nagjibhai	138562005247	Harendragiri Somgiri Gosai	
Nagjibhai Desai			Bhadcha	Branch Name	: Talod, Gujarat	
Branch Name: Dwarka-Gujarat		Branch Name: Lalpur Road		363462008725	Sonalben	
170362020335	llaben	309562000294			Chauhan	
Rameshbhai		Madhabhai		Branch Name: Thaltej		
1	Nakum		Sagar Kadiya	045762003172	Drashti	
Branch Name: Gondal		Branch Na	me: Mahuva	Corporation		

SAKAR HEALTHCARE LIMITED

[CIN: L24231GJ2004PLC043861] Registered Office: Block No. 10-13, Sarkhej-Bavla Road, Village: Changodar, Dist: Ahmedabad - 382 213 NOTICE FOR 21ST ANNUAL GENERAL MEETING AND E-VOTING

NOTICE is hereby given that the 21st Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, the 23rd September, 2025 at 1.00 p.m. IST through Video Conference ("VC") Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice dated 25th July, 2025 convening the AGM in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs, General Circular No. 9/2024 dated September 19, 2024 read with the requirements laid down in Para 3 and Para 4 of the General Circular No.20/2020 dated 5th May, 2020 and earlier circulars issued in this regard extending relaxation by the Ministry of Corporate Affairs ("MCA circulars") read with the Securities and Exchange Board of India Circular dated October 3, 2024 ("SEBI Circular") Accordingly, the Company has sent the Annual Report 2024-25 along with the Notice convening AGM through electronic mode only to the members whose email addresses are registered with the Company and/or Depositories. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of Company at - www.sakarhealthcare.com and on the website of Central Depository Services (India) Limited at www.evotingindia.com and also on website of National Stock Exchange of India Limited at www.nseindia.com.

As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote evoting' as under and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and

F	Rules made there under are given here under:		
1	Date of completion of dispatch of Notice of AGM through email only	28th August, 2025	
2	Date & Time of commencement of Remote e-voting	9.00 a.m. on 20th September, 2025	
3	Date & Time of end of Remote e-voting	5:00 p.m. on 22nd September, 2025	
4	Cut-off date for determining rights of entitlement of Remote e-voting	16th September, 2025	

Those persons who have acquired shares and have become members of the Company after emailing of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as

mentioned in the said Notice of AGM. Remote e-voting shall After 5:00 p.m. on 22nd September, 2025

not be allowed beyond E-voting facility will be available during AGM. Members Manner of casting e-votes on who have already cast their vote by remote e-voting prior resolutions during AGM (VC/OAVM) to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their e-vote again during AGM. Electronic Voting system & Central Depository Services (India) Limited VC/OAVM platform provider www.evotingindia.com Contact details of person Mr. Rakesh Dalvi, Manager responsible to address the Central Depository Services (India) Limited 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, grievances connected with e-voting system

Lower Parel (E), Mumbai - 400 013 E Mail ID -helpdesk.evoting@cdslindia.com Phone No. - 18002109911 By Order of the Board,

for SAKAR HEALTHCARE LIMITED **Bharat Soni** Place: Ahmedabad **Company Secretary & Compliance Officer** Date: 28th August, 2025

GUJARAT CRAFT INDUSTRIES LIMITED

NOTICE FOR 41ST ANNUAL GENERAL MEETING AND E-VOTING

Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com.

[CIN: L25111GJ1984PLC007130] Reg. Office: Plot No. 431, Santej-Vadsar Road, Village:Santej, Taluka:Kalol, Dist:Gandhinagar-382 721

NOTICE is hereby given that the 41st Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Monday, the 29th September, 2025 at 1.00 p.m. IST through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice dated 26th July, 2025 convening the AGM. The Company has sent the Annual Report 2024-25 along with the Notice convening the AGM in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs, General Circular No. 9/2024 dated September 19, 2024 read with the requirements laid down in Para 3 and Para 4 of the General Circular No.20/2020 dated 5th May, 2020 and earlier circulars issued in this regard extending relaxation by the Ministry of Corporate Affairs ("MCA circulars") read with the Securities and Exchange Board of India Circular dated October 3, 2024 ("SEBI

t MICA CITCUIAIT 3 FEAU WILL THE SECURINES AND EXCHAINGE BOARD OF INDIA CITCUIAIT DATE OF CONTROLL AND THE SECURINES AND EXCHAINGE BOARD OF THE SECURINES AND E Notice is hereby given that as per Rule 42 of the SEBI Listing Rules, the Board of the Company has fixed September 22, 2025 as the record date for determining the shareholders authorized to receive the final dividend As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' as under and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the

Companies Act, 2013 and Rules made there under are given here under:

1	Date of completion of dispatch of Notice of AGM through email only	28th August, 2025
2	Date & Time of commencement of Remote e-voting	9.00 a.m. on 26th September, 2025
3	Date & Time of end of Remote e-voting	5:00 p.m. on 28th September, 2025
4	Cut-off date for determining rights of entitlement of Remote e-voting and Dividend	22nd September, 2025
5	Those persons who have acquired shares and have become members of the Company after emailing	

of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM

6	Remote e-voting shall not be allowed beyond	After 5:00 p.m. on 28th September, 2025	
7	Manner of casting e-votes on resolutions during AGM (VC/OAVM)	E-voting facility will be available during AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their e-vote again during AGM.	
8	Electronic Voting system & VC/OAVM platform provider	Central Depository Services (India) Limited www.evotingindia.com	
9	Contact details of person responsible to address the grievances connected with e-voting system	Mr. Rakesh Dalvi, Manager Central Depository Services (India) Limited 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 013 E Mail ID -helpdesk.evoting@cdslindia.com Phone No 18002109911	

By Order of the Board For GUJARAT CRAFT INDUSTRIES LTD,

Sejal Kanbi Company Secretary & Compliance Officer

: 28th August,2025 Jigar Mukeshbhai Shah MANAGING DIRECTOR (DIN NO - 06605922)

For, TIRTH PLASTIC LIMITED

Sd/-

બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ

(એજન્સી)નવી દિલ્હી, ે કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકારો એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી ન કરી શકે જે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર લીધો હોય, ભલે રાજ્ય એમ કહે કે તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ વાત કહી. બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકર પણ સામેલ હતા. મહેતાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એ બાબત પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવા માંગે છે કે શું રાજ્ય સરકારો બંધારણની કલમ ૩૨ હેઠળ આવી અરજીઓ દાખલ કરી શકે છે? તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ એ પણ જાણવા માંગે છે કે, બંધારણની કલમ ૩૬૧નો દાયરો શું છે. આ આર્ટિકલ કહે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાની સત્તાઓ અને ફરજોના નિર્વાહ માટે કોઈપણ કોર્ટ પ્રત્યે

સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ

સમસ્યાઓ પૈકી જળસકંટની મુખ્ય

સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે

ગુજરાતમાં જળસંકટ સામે લડવાની

પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી

છે, તેવા ગુજરાત રાજયના પનોતા

પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા

મનસુખભાઈ સુવાગીયા લિખિત

જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા.૩૧મી

ઓગષ્ટ, ૨૦૨૫ના રોજ રવજીભાઈ

વસાણી અને વલ્લભભાઈ

કાકડિયાની આગેવાનીમાં લેઉવા

પટેલની ૧૯ સંસ્થાઓના ઉપક્રમે

લેઉવા પટેલ સમાજની સંસ્થા,

કેળવણી ધામ નિકોલ ખાતે રાજયનાં

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

પટેલનાં હસ્તે કરવામાં આવશે.

'જળક્રાંતિ ગ્રંથ'ના વિમોચન પ્રસંગે

ગુજરાતભાજપના પ્રમુખ

બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ એએસ ચંદુરકર સામેલ હતા

જવાબદાર રહેશે નહીં.

મહેતાએ બંધારણીય બેંચને જણાવ્યું કે, આ સવાલો પર અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. પરંતુ રાષ્ટ્રપતિનો મત છે કે કોર્ટનો સ્પષ્ટ અભિપ્રાયે જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં આવો મામલો ફરી ઉઠી શકે છે. તેમણે કહ્યું કે, કલમ ૩૨ હેઠળ રાજ્ય સરકાર વતી રાષ્ટ્રપતિ કે राज्यपासना निर्शयोने पर्रेडारती અરજી સ્વીકારી શકાતી નથી. આવા કેસોમાં કોર્ટ નઈ તો નિર્દેશ આપી શકે છે અને ન તો આ નિર્ણયોને કોર્ટમાં

પડકારી શકાય છે. તેમણે આગળ કહ્યું કે, કલમ ૩૨નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. પરંતુ બંધારણીય માળખામાં રાજ્ય સરકાર પોતે મૂળભૂત અધિકારો ધરાવતી નથી. રાજ્ય સરકારની ભૂમિકા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે.

'જળક્રાંતિ ગ્રંથ'નું વિમોચન મુખ્યમંત્રી

ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૩૧મી ઓગષ્ટે ચોજાશે

વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ,

કાનજીભાઈ ભાલાળા સહિત

ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત

મન્સુખભાઈ સુવાગીયાએ

સ્વલિખિત 'જળક્રાંતિ ગ્રંથ' અંગે

જણાવ્યું હતું કે, મારા ૩૦ વર્ષના

જળરક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા

જળસંકટના જ્ઞાન અને અનુભવોની જાણકારી ભાવિ પેઢીને મળી રહે તે

માટે 'જળક્રાંતિ ગ્રંથ' લખવાની મને

પ્રેરણા મળી. જે માટે મે સતત ૯૭

દિવસ બરડા ડુંગરમાં આવેલી

ઐતિહાસિક નગરી ધુમલીની

તપોવન વિદ્યાપીઠમાં રહી રરપ

પાનાનો 'જળક્રાંતિ ગ્રંથ' લખ્યો છે.

આ ગ્રંથમાં જળતત્વ, વરસાદના

સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પ્રકાર, નક્ષત્રનાં ગુણધર્મો, વિજળી રાષ્ટ્રસેવામાં વાપરવામાં આવે છે.

રાજયમાં જળક્રાંતિ લાવનાર

વાં સજાળિયા,

જે રામભાઈ

રહેશે.

મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, અને મેઘગર્જનાનો પ્રભાવ, ભુગર્ભ

મર્યાદામાં બિલો પર નિર્ણય નહીં લે, તો રાજ્ય સીધું સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

આના પર સીજેઆઈ ગવઈએ કહ્યું હું ૮ એપ્રિલના બે જજોના નિર્ણય પર કોઈ ટિપ્પણી નહીં કરીશ, પરંતુ એમ પણ કહ્યું કે રાજ્યપાલ દ્વારા કોઈ પણ બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી. મહેતાએ જવાબમાં કહ્યું કે જો કોઈ બંધારણીય સંસ્થા પોતાની ફરજોનું પાલન નથી કરતી, તો તેનો અર્થ એ નથી કે કોર્ટ બીજી બંધારણીય સંસ્થાને આદેશ આપી દે.

તેના પર ઝતેં એ કહ્યું કે, હા અમે સમજીએ છીએ કે તમે શું કહી રહ્યા છો. પરંતુ જો આ કોર્ટ પોતે જ ૧૦ વર્ષ સુધી કોઈ કેસનો ઉકેલ ન લાવે, તો શું રાષ્ટ્રપતિને કોઈ આદેશ આપવાનો અધિકાર રહેશે? સુનાવણી હજુ પણ ચાલુ છે. ૨૬ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, જો સોલિસિટર જનરલે ૮ એપ્રિલના એ રાજ્યપાલ કોઈ બિલ પર અનિશ્ચિત નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સુપ્રીમ સમય સુધી નિર્ણય ન લે, તો શું કોર્ટ પાસે કોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યપાલ સમય કોઈ ઉપાય નહીં રહેશે? શું બજેટ જેવા

જળ પરિક્ષણ, જળરક્ષાના મોડેલ

ગામોનો ઈતિહાસ, વિશ્વ જળસંકટ

નિવારણનો ઉપાય અને માનવ

ઘડતર તથા કર્મથી જીવનપ્રાપ્તિ જેવા

આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ

આ 'જળક્રાંતિ ગ્રંથ' ૨૦થી વધુ વિદ્ધાનોએ વાંચીને વિશ્વ પ્રેરક

જુળવિજ્ઞાન અને જળક્રાંતિના

ઈતિહાસ તરીકે વર્ણવ્યો છે.

'જળક્રાંતિ ગ્રંથ' ગુજરાતી, હિન્દી

અને અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ કરીને

સમગ્ર વિશ્વના ૨૦૦ દેશોમાં મોકલી

આપી જળસંકટ નિવારણની પ્રેરણા

આપવામાં આવશે. 'જળક્રાંતિ ગ્રંથ'

સિવાય મારા લિખિત અન્ય આઠ

ગ્રંથોના વેચાણમાંથી પ્રાપ્ત થતી

આવક જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે

નોંધાશે. ઈ વાય દ્વારા ઓગસ્ટમાં જાહેર ઈકોનોમી વોચ રિપોર્ટ

અનુસાર, ભારતનો ગ્રોથ ફક્ત વસ્તી વિષયક માહિતી સુધી જ નહીં પરંતુ માળખાકીય સુધારાઓ અર્ને સ્થિતિસ્થાપક મૂળભૂત બાબતોમાં પણ મજબૂત બન્યો છે.

કરતાં ભારત હાલ વિશ્વની ચોથી ટોચની અર્થવ્યવસ્થા બન્યું છે. મજબૂત આર્થિક પાયા સાર્થે દેશ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે. ટેરિફમાં પ્રેશર અને મંદ વેપાર જેવા વૈશ્વિક પડકારો હોવા છતાં સ્થાનિક માગમાં વધારો અને આધુનિક ટેક્નોલોજીની વધતી ક્ષામતાઓના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત છે. આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી

ઈવાય રિપોર્ટ અનુસાર,

સુપ્રીમ કોર્ટ હાલમાં રાષ્ટ્રપતિ તરફથી એક બંધારણીય સંદર્ભે પર સુનાવણી કરી રહી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું કોર્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને એ નિર્દેશ આપી શકે કે, તેઓ ધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લઈ લે? મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કલમ ૧૪૩ (૧) હેઠળ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો કે, શું કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપી શકે કે, કે રાજ્ય વિધાનસભાથી આવેલા બિલો પર ક્ચારે અને કેવી રીતે નિર્ણય લે.

ભારત ૨૦૩૮ સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે

(એજન્સી)નવી દિલ્હી, ભારત પર અમેરિકાએ પ૦ ટકા ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે સફળ નહીં થાય. ભારત ૨૦૩૮ સુધીમાં વિશ્વનું બીજુ ટોચનું અર્થતંત્ર બનવાનો દાર્વો ઈવાય રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ બિલ પણ રાજ્યપાલની

સ્વતંત્ર સત્તાને કારણે અટકી શકે છે?

સુપ્રીમ કોર્ટે આ સવાલ ત્યારે ઉઠાવ્યો

જયારે કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ

કહ્યું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બિલ

पर निर्शय बेवानी संपूर्ण स्वतंत्रता

હોવી જોઈએ. આ રાજ્યોએ એમ પણ

કહ્યું હતું કે કોર્ટ દરેક સમસ્યાનો ઉકેલ

૩૪.૨ લાખ કરોડ ડોલર

ઓગસ્ટમાં જાહેર ઈકોનોમી વોચ રિપોર્ટ વિકસિત છે.

તમામ પડકારોનો સામનો

૨૦.૭ લાખ કરોડે આંબશે.

અમેરિકા, ચીન, જર્મની અને

જાપાનની તુલનાએ ભારતની આર્થિક સ્થિતિ સારી છે. ચીન ૨૦૩૦ સુધીમાં અંદાજિત ૪૨.૨ લાખ કરોડ ડોલરનો જીડીપી હાંસલ કરી શકે છે. જો કે, વૃદ્ધોની વધતી વસ્તી અને વધતુ દેવું તેના માટે પડકારરૂપ બની શર્કે છે. અમેરિકાએ ટેરિક લાદતાં ભારતનો જીડીપી ૨૦૩૮ સુધીમાં અમેરિકા પર મોંઘવારીનો બોજો

વધશે. જેથી તેની જીડીપી મંદ ઈવાય દ્વારા રહેવાની ભીતિ છે. જર્મની અને જાપાન પણ

પરંતુ તે મુખ્યત્વે વૈશ્વિક વેપાર પર નિર્ભરતા ધરાવે છે. જ્યારે ભારતની પાસે વિવિધ ક્ષેત્રે અઢળક ક્ષમતા જોવા મળી છે. તેની વધતી યુવા વસ્તી, સ્થાનિક માગ અને ટકાઉ રાજકોષિય આઉટલુકના કારણે જીડીપી ગ્રોથ વધશે. સ્થાનિક માગની સાથે સાથે સ્થાનિક ઉત્પાદનને પણ વેગ અપાઈ રહ્યો છે. જે જીડીપીને ટેકો

ઈવાય ઈન્ડિયાના ચીફ સ્ટ્રેટેજિસ્ટ એડવાઈઝર ડીકે શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારતની તલનાત્મક ક્ષમતાઓ, યુવા વસ્તી અને કુશળ કાર્યબળની સાથે સાથે મજબૂત બચત અને રોકાણ દેશના ગ્રોથમાં વધારો કરશે. ટેક્નોલોજીની ઉજ્ઞત ક્ષમતાઓનું નિર્માણ કરતાં ૨૦૪૭ સુધીમાં ભારત પોતાની વિકસિત અર્થતંત્રની મહત્ત્વાકાંક્ષા હાંસલ કરી શકે છે.

TIRTH PLASTIC LIMITED

Regd. Office: 602, 6th FLOOR, ONE WORLD WEST,S.NO. 396,F.P.119 NR VAKIL BRIDGE, BOPAL, AMBLI ROAD, VILLAGE VEJALPUR, AHMEDABAD GJ 380051 IN

NOTICE OF THE 39th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION, INFORMATION FO **VC/OAVM AND BOOK CLOSURE DATES**

VC/OAVM AND BOOK CLOSURE DATES

Notice is hereby given that the 39th Annual General Meeting (AGM) of the company will be held on Tuesday, 23rd September, 2025 at 12.00 P.M through Video Conference (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with provisions of Companies Act, 2013 and the rules made thereunder and the SEBI(LODR) Regulation, 2015 No. 14/2020 dated 8th April 2020, Circular No. 17/2020 dated 13th April 2020, Circular No. 10/2022 dated 28th December 2022 (collectively referred to as MCA Circulars') and SEBI Circular No. SEBI/HO/CFD/CDD1/CIR/P/2020/79 dated 12th May 2020 read with SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars") Securities and Exchange Board of India ("SEBI Circulars") permitted the holding of an Annual General Meeting ("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), and other circulars issued by Ministry of Corporate Affairs, Government of India and SEBI, to transact the businesses that will be set forth in the Notice of the Meeting. The aforesaid Notice and the Annual Report of the company for the year ended 31st March, 2025 will be sent in electronic mode

to all the members whose e-mail ids are registered with the Company / Depository Participants The Notice of the AGM and the Annual Report will also be available and can be downloaded from the website of the Company i.e. https://www.tirthlimited.in/Annual%20Reports/2024-25/

from the website of the Company i.e. https://www.tirthlimited.in/Annual%20Reports/2024-25/
Annual%20Report%20Tirth.pdf and on the website of the Bombay Stock Exchange i.e. www.bseindia.com.
Process for those shareholders whose email ids are not registered with the depositories for procuring user id and password and registration of e mail ids for e-voting for the resolutions set out in this notice

In case shares are held in physical mode please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) by email to (tirthplastic@gmail.com).

In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) to (tirthplastic@gmail.com). If you are an Individual shareholders holding securities in demat mode, you are requested to refer to the login method explained at step 1 (A) i.e. Login method for e-Voting and joining virtual meeting for Individual shareholders holding securities in demat mode.

Alternatively shareholder/members may send a request

 Alternatively shareholder/members may send a request to evoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing above mentioned documents.

Pursuant to section 91 of the companies Act, 2013 and Pursuant to section 91 of the companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer books of the company shall remain closed from 17th September, 2025 to 23rd September,2025 (both days inclusive) for the purpose of the AGM to be held on Tuesday, 23rd September, 2025.

The company is pleased to provide all its members (holding shares both in physical and in electronic form) the facility to exercise their vote through remote exercise their vote through remote exercise to provide the

shares both in physical and in electronic form) the facility to exercise their vote through remote e-voting to be provided by National Securities Depository Limited (NSDL). Members of the company holding shares in physical or dematerialised from as on cut-off date i.e. 16th September, 2025 may cast their votes through remote e-voting. The remote e-voting shall commence on Saturday, 20th September, 2025 at 9:00 A.M and ends on Monday, 22nd September, 2025 at 5:00 P.M.

The Board of Directors has appointed M/s. A SHAH & ASSOCIATES Practicing Company Secretaries (FCS-4713)

The Board of Directors has appointed M/s. A SHAH & ASSOCIATES, Practicing Company Secretaries (FCS-4713/CP NO-6560) as Scrutinizer to scrutinize the remote E-voting process voting at the AGM in fair and transparent manner. The members attending the meeting who have not casted their vote by remote e-voting will be eligible to cast their vote through e-voting during the AGM. Members who have casted their votes by remote e-voting prior to the meeting may attend the meeting but shall not be entitled to cast their vote again. The cut-off date is regard date) for the purpose of remote e-voting is 16th i.e. record date) for the purpose of remote e-voting is 16th

September, 2025.
Only those members who have registered themselves as a speaker before 7 days of AGM will be allowed to express their views/ask questions during the AGM.
Any person who acquires shares of the company and becomes member of the company after the despatch of the Notice and holding shares as of the "cut-off date" i.e. 16th September, 2025, may obtain the login ID and password by sending a request at evoting @msdl.co.in. However, if the member is already registered with NSDI for remote exprising then the existing user. registered with NSDL for remote e-voting then the existing user ID and password can be used for remote e-voting. For the process and manner of remote e-voting, members may

go through the remote e-voting instructions sent via e-mail to the members whose e-mail IDS are registered with the Company / Depository Participant and physical copy sent to the other members or visit NSDL'S website.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to KETANKUMAR PATEL at evoting@nsdl.co.in

MANAGING DIRECTOR (DIN NO - 06605922)

For, TIRTH PLASTIC LIMITED Place: Ahmedabad Sd/-: 28th August,2025 Jigar Mukeshbhai Shah

PUBLIC NOTICE (શેલ્ડ. ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, ચકલી સર્કલ પાસે, જુના પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૭ કોર્પોરેટ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાવર્સ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧

ગોલ્ક ઇન્હરાસું કર્યા કરાયા રહે આફિસ : આઇસાઆઇ બાન્ક ટાવસ, બાંદ્રા-કુલાં કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧ ગોલ્ક ઇન્હરાસુ ક્રમ આમંત્રા સૂચના નીચે જણાવેલા ઋણ લેનારાઓને સોનાના દાગીના સામેની સુવિધા માટે તેમની બાડી રકમ ચૂકવવા નોટિસ આપવામાં આવી છે. ('સુવિધા') તેઓ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ('આઈસીઆઈસીઆઈ') પાસેથી મેળવે છે. અમે ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ગીરવે મૂર્ટલા સાનાના ઘરેણાંની ઈ-ઓક્શન કરવા માટે મજબૂર છીએ કારણ કે તેઓ બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બંધ કરવાની/ઇ-ઓક્શન કરવા માટે મજબૂર છીએ કારણ કે તેઓ બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બંધ કરવાની/ઇ-ઓક્શનની તારીખ બદલવાની સત્તા છે. ઓનલાઈન હરાજ https://jewel-auction.procuretiger.com બપોરે ૧૨:૩૦ થી ૩:૩૦ વચ્ચે યોજારો. વિગતવાર નિયમો અને શરતો માટે, કૃયા કરીને આપેલ વેબસાઇટ પર લોગ ઇન કરો. ઉધાર લેનારનું જે મૃત્યુ થયું હોય તો તે કિસ્સામાં, તમામ શરતો કૃતી વારસદારોને લાગુ પડશે.

લાન ખાતા ન.	ગ્રાહરની વામ	લાન ખાતા ન.	ગાહરની વામ	લાન ખાતા ન.	ગ્રાહકનું નામ
શાખાનું ન	ામઃ અમરેલી	048662010528	સરસીયા કનુબેન જયંતિલાલ	183162014592	નીરવભાઈ રાજેન્દ્રભાઈ
072562011782	તાલાવીયા પ્રદીપ મધુભાઈ	शाणानुं	नामः हालोल		વોરા
9Indlef	નામઃ આણંદ	177062001507	સોની રાજેન્દ્રકુમાર	શાખાનું નામઃ	મોરબી, ગુજરાત
025662005247	પરમાર કેતેન્દ્રસિંઘ	शाणानुं त	नामः पशस्य	362457000005	નિશાંત રસિકલાલ મકવાણા
	ગુલાબસિંહ	170862013345	વલ્લભભાઈ ગભરુભાઈ એઆઈ	શાખાનું નામઃ રા	ાજકોટ-એસ્ટ્રોન ચોક
શાખાનું	નામઃ બાપોદ	શાખાન્	ું નામઃ કડી	331105001045	હિતેશ વાલાભાઈ સાબંદ
763262001114	જાદવ સતીષભાઈ	044262011227	આશીકખાન યુસુકખાન		
શાખાનું નામઃ બારકોલી			બલોચ	શાખાનું ન	ામઃ રાજપીપલા
045962010066	વારુ જેક અનિલભાઈ	शामार्ग नाम	કડોદરા, ગુજરાત	137757000107	નેશનલ એગ્રો
વારું જ ક આવલામાં છ		347857000010	અભિષેક કમાર સિંઘ	શાખાનું લ	ગામઃ શિદ્ધપુર
શાખાનું	નામઃ બોટાદ	347857000010	આભવક કુમાર ાસઘ	183457000121	આચાર્ય હિંચીતભાઈ રાકેશકુમા
137562043925	ભપતભાઈ મનજીભાઈ કાલીયા	શાખાનું	નામઃ ખેડા	1	-
		202057000071	પ્રદીપ ચાવડા	शाजानुं ना	મઃ સુરત-ઉદ્યના
શાખાનું નામઃ ડીસા		શાખાનું ન	નામઃ લાખાણી	138562005247 હરેન્દ્રગીરી સોમગીરી ગોસા	
049762020885	સુરેશભાઈ નાગજીભાઈ દેસાઈ	761162001032	પ્રવીણભાઈ નાગજીભાઈ	138562005247	હરજગારા સામગારા ગાસાઇ
			ભડચા	શાખાનું નામ	: તલોદ, ગુજરાત
શાખાનું નામઃ હારકા-ગુજરાત		શાખાનું નામઃ લાલપુર રોડ		363462008725	સોનલબેન ચૌહાણ
170362020335	ઈલાબેન રમેશભાઈ	309562000294			-
નકુમ		330.00 0 0 0 0 0 0		શાખાનું નામઃ ચલતેજ	
				045762003172	દ્રષ્ટિ કોર્પોરેશન
શાખાનું	નામઃ ગૌકલ	શાખાનું	નામઃ મહુવા		31 11 11
413hu · 26 64 26	211			0. 0	

AGM ની નોટિસ ફક્ત ઇમેઇલ દ્વારા

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૫

મોકલવાની કામગીરી પૂર્ણ કર્યાની તારીખ

રલ.છ.૨૭૯૧ અમદાવાદ, મોરબી, વડોદરા, સુરત, બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ખેડા, નર્મદા, પંચમહાલ, પાટણ

. હરેન્દ્રગીરી સોમગીરી ગોસાઇ તલીદ, ગુજરાત સહી/- અધિકૃત અધિકારી

આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ વતી

સાકાર હેલ્થકેર લિમિટેડ [CIN: L24231GJ2004PLC043861]

૨૪૪. ઓફિસઃ બ્લોક નું.૧૦-૧૩, સરખેજ-બાવળા રોડ, ગામ-ચાંગોદર, જી. અમદાવાદ-૩૮૨૨૧૩ ૨૧મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ અંગે નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીના સભ્યોની ૨૧મી વાર્ષિક સામાન્ય સભા (AGM) મંગળવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧.૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (VC)/ અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા ૨૫મી જુલાઈ, ૨૦૨૫ની AGM ની જાણ કરતી નોટિસમાં જુણાવેલ કામકાજ સારું કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર નં. ૦૯/૨૦૨૪ તા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ તેમજ સામાન્ય પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તા. પમી મે, ૨૦૨૦ના પેરા ૩ અને ૪ માં દર્શાવેલી જરૂરિયાત પ્રમાણે અને આ વિષય માટે પૂર્વમાં જાહેર કરેલા પરિપત્રો તેમજ સિક્ચોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના તા. ૩જી ઓક્ટોબર, ૨૦૨૪ ના પરિપત્ર (SEBI પરિપત્ર) અનસાર મળશે. ઉપરોક્ત પરિપત્ર અનસાર કંપની અને/અથવા ડિપોઝિટરીમાં જેમના ઇમેઇલ નોંધાયેલ છે તેવા જ સભ્યોને કંપનીએ AGMની નોટિસ સાથે વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨પઇમેઇલ દ્વારા મોકલ્યો છે. AGMની નોટિસ સાથે કંપનીનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.sakarhealthcare.com અને સેન્ટ્લ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડની વેબસાઇટ www.evotingindia.com પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ની વેબસાઇટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ તેમજ સેબી (એલઓડીઆર) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૪૪ અન્વયે કંપની તેના સભ્યોને નોટિસમાં જણાવેલ ઠરાવો ઉપર મત આપવા માટે 'રિમોટ ઇ-વોટિંગ' અને **AGM** સમયે 'ઇ-વોટિંગ' ની સુવિધાઓ આપે છે. કંપની ધારા, ૨૦૧૩ અને તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર જરૂરી વિગતો અહી નીચે જણાવેલ છેઃ

૨૮મી ઓગસ્ટ, ૨૦૨૫

	113 -1 11 11 31 1 11 11 231 3 11 11 11 11 11		
₹.	રિમોટ ઇ-વોટિંગના પ્રારંભની તારીખ અને સમય	૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫, સવારે ૯.૦૦ વાગે	
з.	રિમોટ ઇ-વોટિંગના સમાપનની તારીખ અને સમય	૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫, સાંજે ૫.૦૦ વાગે	
۲.	રિમોટ ઇ-વોટિંગના હક્ક નક્કી કરવા માટેની કટ-ઑફ તારીખ	૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૫	
ч.	ા. કંપની દ્વારા AGMની નોટિસ ઇમેઇલ કર્યા પછી કંપનીના શેર હસ્તગત કર્યા હોય અને કંપનીના સભ્યો બન્યા હોય તેમજ કટ-ઑફ તારીખ સુધીમાં ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા સ્ટેટમેન્ટ ઓફ બેનેફિશિયલ ઓનર્સ/ કંપનીના સભ્યોના રજિસ્ટરમાં નામ ધરાવતા હોય તેવી વ્યક્તિ AGMની નોટિસમાં દર્શાવેલી પ્રક્રિયા બાદ રિમોટ ઇ-વોટિંગ પદ્ધતિ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.		
٤.	રિમોટ ઇ-વોટિંગ કરી શકશે નહીં	૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫, સાંજે ૫.૦૦ વાગ્યા પછી	
Э.	AGM (VC/OAVM) દરમિયાન ઠરાવો પર	AGM દરમિયાન ઇ-વોટિંગની સુવિધા મળશે. જે સભ્યોએ AGM ઇ-મત આપવાની રીત પહેલા રિમોટ ઇ-વોટિંગ દ્વારા પહેલાથી જ પોતાનો મત આપ્યો છે તે VC/OAVM દ્વારા AGM માં હાજર રહી શકશે, પરંતુ AGMમાં ફરીથી ઇ-મત આપવા માટે હકદાર રહેશે નહીં.	
८.	ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઇ-મત) અને VC/ OAVM પ્લેટફોર્મ પ્રદાતા	સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ www.evotingindia.com	
૯.	રિમોટ ઇ-વોટિંગ (ઇ-મત) અંગે ફરિયાદ નિવારવા જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો	શ્રી રાકેશ દલવી, મેનેજર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ ૨૫મો માળ, એ વિંગ, મેરેથોન ક્યુચરએક્સ, મફતલાલ મિલ્સ કંપાઉન્ડ, એન.એમ.જોશી માર્ગ, લોઅર પરેલ (ઇ), મુંબઇ – ૪૦૦ ૦૧૩ ઇ મેઇલ આઈડી -helpdesk.evoting@cdslindia.com ફોન નંબર – ૧૮૦૦૨૧૦૯૯૧૧	

બોર્ડના હુકમથી સાકાર હેલ્થકેર લિમિટેડ વતી, ભરત સોની કંપની સેક્રેટરી અને ક્મ્પ્લાયન્સ ઓફિસર

લેસ્ટર્ને ટાઇક્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ

પોતાની રીતે ચકાસણી કરી

નામ બદલેલ છે

મેં મારું નામ પટેલ અવની

ભાવેશકુમાર હતું, જે બદલીને

અવની ભાવેશભાઈ પટેલ

કરેલ છે.

સરનામું : ૧૪/૧, આનંદફલેટ.

બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪

નામ બદલેલ છે

મેં મારું નામ પટેલ મીતાબહેન

ભાવેશ હતું, જે બદલીને

મીતાબેન ભાવેશભાઈ પટેલ

કરેલ છે.

સરનામું : ૧૪/૧, આનંદફલેટ,

બાપુનગર, અમદાવાદ-૩૮૦૦૨૪

-જાહેરખબર મેનેજર

નિર્ણય લેવો.

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative. EKA Club, Gate No 3, Kankaria,

Franklin Templeton Mutual Fund

Ahmedabad - 380022. Date: 31st Aug, 2025

Time: 11:00 a.m. Contact Person: Utkarsh Rastogi (7710801123)

Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow. We look forward to your participation



FRANKLIN TEMPLETON

Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg. Elphinstone (West) Mumbai - 400013

read all scheme related documents carefully.

PUBLIC NOTICE

િ ICICI Bank રજિ. ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, ચકલી સર્કલ પાસે, જૂના પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૭

કોર્પોરેટ ઓફિસઃ આઈસીઆઈસીઆઈ બેન્ક ટાવર્સ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧

કોપાસ્ટ આફ્સ : આઇસાંબાઇ સાંબાઇ અંજ ટાયસ, ખાકા-કુલા કામ્પ્લક્સ, મુંબઇ ૪૦૦૦વ મેં એલ્ડિક કર્યાસ, ખાકા-કુલા કામ્પ્લક્સ, મુંબઇ ૪૦૦૦વ મેં એલ્ડિક કર્યાસ, અમાંગ્રેગ્ર સુચલા નોટિસ આપવામાં આવી છે. ('સુવિયા') તેઓ આઈસીઆઈ બીઆઈસીઆઈ બેંક લિમિટેડ ('આઈસીઆઈસીઆઈ ') પાસેથી મેળવે છે. અમે ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બીરતે મુક્લા સોનાના ઘરેણાંની ઇ-ઓક્શન કરવા માટે મજબૂટ છીએ કારણ કે તેઓ ભાડી ચૂક્તથી કરવામાં નિષ્ણ ગયા છે. આઇસીઆઇસીઆઈ બેંક પાસે કોઇપણ પૂર્વ સુવા વિના ખાતું બંધ કરવાની/ઇ-એક્સનની તારીખ ભરલવાની સતા છે. આઇસીઆઇસીઆઈ બેંક પાસે કોઇપણ પૂર્વ સુવા વિના ખાતું બંધ કરવાની/ઇ-એક્સનની તારીખ ભરલવાની સતા છે. ઓનલાઈન હરાજી https://jewel-auction.procuretiger.com બપોરે ૧૨:૩૦ થી ૩:૩૦ વચ્ચે યોજાશે. વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને આપેલ વેબસાઇટ પર લોગ ઇન કરો. ઉધાર લેનારનું જો મૃત્યુ થયું હોય તો તે કિસ્સમાં તામા પ્રગત્નો કરતી વાર્ચરાઇનો લાગ પછી કિસ્સામાં, તમામ શરતો કાનુની વારસદારોને લાગુ પડશે.

> **લોન ખાતા નં.** ગ્રાહકનું નામ શાખાનું નામઃ બંગ્લોર ઈલેક્ટ્રોનિક સીટી પીએચ-૧

036005017410 હિમાંશુ પંચાલ

સહી/- અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ વતી

ઈન્ડો યુએસ બાયો ટેક લિમીટેડ

(CIN: L01122GJ2004PLC043550)

૨૪૪. ઓફિસઃ ૩૦૯, શાંતિ મોલ, સતાધાર ચાર રસ્તા, નવરંગ ટાવરની સામે, સોલા રોડ, અમદાવાદ-૩૮૦૦૬ ૧

શેરહોલ્ડરોને ૨૧મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, ઈન્ડો યુએસ બાયો ટેક લિમીટેડ (કંપની)ના સભ્યોની ૨૧મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ને મંગળવારે બપોર ૦૨.૩૦ (IST) કલાકે યોજાવાની છે. વિડીયો કોન્ફરન્સિંગ ("VC") દ્વારા અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ("OAVM") દ્વારા એજીએમની નોટિસમાં જણાવ્યા મુજબ વેપારનો વ્યવહાર કરવા. એજીએમની નોટિસમાં નિર્ધારિત કરેલા વ્યવસાયોને વ્યવહાર કરવા માટે જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી

૦૮ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ અનુસાર, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા ૧૩ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ એ ૫ મેં, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા પરિપત્ર દ્વારા ૮ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા પરિપત્ર; ૧૩ એપ્રિલ, ૨૦૨૦; ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧; ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ (સામૂહિક રીતે MCA પરિપત્રો તરીકે ઓળખાય છે) સાથે વાંચવામાં આવ્યો છે, અને ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૦૯/૨૦૨૪, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલા પરિપત્ર અને SEBI દ્વારા જારી કરાયેલા પરિપત્ર નં. SEBI/HO/CFD/CFDPoD-2/P/ CIR/ 2024/133 તારીખ્ ૩ ઓક્ટોબર, ૨૦૨૪ (SEBI પરિપત્ર) એ સભ્યોની ભૌતિક હાજરી વિના, વિડિઓ કોન્ફરન્સિંગ (VC) અથવા અન્ય ઑડિઓ વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM/મીટિંગ) બોલાવવાની મંજૂરી આપી હતી. સ્ઝછ પરિપત્રો, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ('અધિનિયમ') અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (SEBI લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) ની જોગવાઈઓ અનુસાર, કંપનીની AGM VC/OAVM દ્વારા યોજાઈ રહી છે.

ઉપરોક્ત પરિપત્રો અનુસાર, વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૦૨૫ સાથે એજીએમની સૂચના ફક્ત તે સભ્યોને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવે છે જેમના ઇમેઇલ સરનામાં કંપની/ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્યો નોંધ લે કે એજીએમની નોટિસ અને ૨૦૨૪-૨૦૨૫નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટઃ https://www.indousagriseeds.com/, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર ઉપલબ્ધ છે અને AGM નોટિસ પણ મળશે. NSDL (રિમોટ ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટેની એજન્સી)ની વેબસાઈટ એટલે કે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સભ્યો કક્ત VC/OAVM સુવિધા દ્વારા એજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે. એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની સૂચનામાં આપવામાં આવી છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ મુજબ કોરમની ગણતરીના હેતું માટે VC/OAVM દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

રિમોટ ઈ-વોટિંગ સુવિધા ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે પ.૦૦ વાગ્યે સમાપ્ત થશે. (ભારતીય સમય મુજબ). જે વ્યક્તિનું નામ કંટ-ઓફ તારીખ એટલે કે સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૫ના રોજ સભ્યો/લાભકારી માલિકોના રજિસ્ટરમાં દેખાય છે તે રિમોટ ઈ-વોટિંગની સુવિધા તેમજ મીટિંગમાં મતદાન કરવા માટે હકદાર હશે. નોટિસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખ એટલે કે સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૫ના રોજ શેરો હોલ્ડ કર્યા પછી કંપનીના સભ્ય બને તે કોઈપણ વ્યક્તિ.

કંપની તેના તમામ સભ્યોને એજીએમની સૂચનામાં દર્શાવ્યા મુજબ તમામ ઠરાવો પર તેમનો મત આપવા માટે રિમોટ ઈ-વોટિંગ સુવિધા (રિમોટ ઈ-વોટિંગ) પૂરી પાડી રહી છે. વધુમાં, કંપની એજીએમ (ઈ-વોટિંગ) દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડી રહી છે, જે એજીએમની સૂચનામાં રિમોટ ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા પ્રદાન કરવામાં

જો સભ્યોએ કંપની/ડિપોઝીટરીમાં તેમના ઈમેલ એડ્રેસની નોંધણી કરાવી ન હોય, તો કૃપા કરીને વાર્ષિક અહેવાલ મેળવવા અને ઈ-વોટિંગ માટે લોગિન વિગતો મેળવવા ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરવા માટે નીચેની સૂચનાઓને અનુસરો.

એ. ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે - કૃપા કરીને indouscs@gmail.com પર ઈમેલ દ્વારા ફોલિયો

નંબર, શેરધારકનું નામ જેવી જરૂરી વિગતો પ્રદાન કરો બી. ડીમેટ મોડમાં શેર ધરાવનાર સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી સહભાગીનો સંપર્ક કરીને અથવા

indouscs@gmail.com પર ઈમેલ દ્વારા નોંધણી કરાવી શકે છે. ૨૧મી એજીએમ નોટિસ બેનપોસ તારીખે શેર ધરાવતા શેરધારકોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર લાગુ કાયદા અનુસાર

ડિસ્પેચ માટે મોકલવામાં આવશે.

iિંઘત કોઈ પ્રશ્રો અથવા સમસ્યાઓ હોય, તો તમે www.evoting.nsdl.com પર

ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો.

સ્થળ : અમદાવાદ તારીખ : ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૫

બોર્ડના હુક્મથી ઈન્ડો યુએસ બાચો ટેક લિમીટેડ, વતી સહી/- જગદીશ અર્જુડીયા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડીન-૦૧૭૪૫૯૫૧

ગુજરાત ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

[CIN: L25111GJ1984PLC007130]

રજી. ઓફિસ : પ્લોટ નં. ૪૩૧, સાંતેજ-વડસર રોડ, ગામઃ સાંતેજ, તાલુકોઃ કલોલ-૩૮૨૭૨૧, જિલ્લો : ગાંધીનગર ૪૧મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગ અંગે નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીના સભ્યોની ૪૧મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧.૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (VC)/ અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા ૨૬મી જુલાઈ, ૨૦૨૫ની AGM ની જાણ કરતી નોટિસમાં જણાવેલ કામકાજ સારું કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી પરિપત્ર નં. ૦૯/ ૨૦૨૪ તા. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ તેમજ સામાન્ય પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તા. પમી મે, ૨૦૨૦ના પેરા ૩ અને ૪ માં દર્શાવેલી જરૂરિયાત પ્રમાણે અને આ વિષય માટે પૂર્વમાં જાહેર કરેલા પરિપત્રો તેમજ સિક્ચોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના તાં. ૩જી ઓક્ટોબર, ૨૦૨૪ ના પરિપત્ર (SEBI પરિપત્ર)અનુસાર મળશે. ઉપરોક્ત પરિપત્ર અનુસાર કંપની અને/અથવા ડિપોઝિટરીમાં જેમના ઇમેઇલ નોંધાયેલ છે તેવા જ સભ્યોને કંપનીએ AGMની નોટિસ સાથે વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ ઇમેઇલ દ્વારા મોકલ્યો છે. AGMની નોટિસ સાથે કંપનીનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.gujaratcraft.com અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડની વેબસાઇટ www.evotingindia.com પર અને BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

આથી એવી પણ નોટીસ આપવામાં આવે છે કે સેબીના લીસ્ટીંગ નિયમોના નિયમ ૪૨ મુજબ કંપનીના બોર્ડે અંતિમ દીવીદંડ પ્રાપ્ત કરવા માટે અધિકૃત શેરધારકોને નિર્ધારિત કરવા માટે ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ને રેકોર્ડ તારીખ તરીકે નિર્ધારિત કરી છે.

કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ તેમજ સેબી (એલઓડીઆર) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૪૪ અન્વયે કંપની તેના સભ્યોને નોટિસમાં જણાવેલ ઠરાવો ઉપર મત આપવા માટે 'રિમોટ ઇ-વોટિંગ' અને AGM સમયે 'ઇ-વોટિંગ' ની સુવિધાઓ આપે છે. કંપની ધારા, ૨૦૧૩ અને તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર જરૂરી વિગતો અહીં નીચે જણાવેલ છે.

٩	a. AGM ની નોટિસ ફક્ત ઇમેઇલ દ્વારા મોકલવાની કામગીરી પૂર્ણ કર્યાની તારીખ	૨૮મી ઓગસ્ટ, ૨૦૨૫ મ	
ર	ર. રિમોટ ઇ-વોટિંગના પ્રારંભની તારીખ અને સમય	ર દ્રમી સપ્ટેમ્બર, ૨૦૨૫, સવારે ૯.૦૦ વાગે	
3	 રિમોટ ઇ-વોટિંગના સમાપનની તારીખ 	અને સમય ર૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫, સાંજે ૫.૦૦ વાગે	
8	રેમોટ ઇ-વોટિંગના અને ડિવિડન્ડનો હક કરવા માટેની કટ-ઑફ તારીખ	ક નક્કી ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫	
ų	કંપની દ્વારા AGMની નોટિસ ઇમેઇલ કર્યા પછી કંપનીના શેર હસ્તગત કર્યા હોય અને કંપનીના સભ્યો બન્યા હોય તેમજ		

કટ-ઑફ તારીખ સુધીમાં ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા સ્ટેટમેન્ટ ઓફ બેનેફિશિયલ ઓનર્સ/ કંપનીના સભ્યોના રજિસ્ટરમાં નામ ધરાવતા હોય તેવી વ્યક્તિ AGMની નોટિસમાં દર્શાવેલી પ્રક્રિયા બાદ રિમોટ ઇ-વોટિંગ પદ્ધતિ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

€.	રિમોટ ઇ-વોટિંગ કરી શકશે નહીં	૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૫, સાંજે ૫.૦૦ વાગ્યા પછી
<u></u> ၅.	AGM (VC/OAVM) દરમિયાન ઠરાવો પર	AGM દરમિયાન ઇ-વોટિંગની સુવિધા મળશે. જે સભ્યોએ AGM ઇ-મત આપવાની રીત પહેલા રિમોટ ઇ-વોટિંગ દ્વારા પહેલાથી જ પોતાનો મત આપ્યો છે તે VC/OAVM દ્વારા AGM માં હાજર રહી શકશે, પરંતુ AGMમાં ફરીથી ઇ-મત આપવા માટે હકદાર રહેશે નહીં.
८.	ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઇ-મત) અને VC/ OAVM પ્લેટફોર્મ પ્રદાતા	સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ www.evotingindia.com
૯.	રિમોટ ઇ-વોટિંગ (ઇ-મત) અંગે ફરિયાદ નિવારવા જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો	શ્રી રાકેશ દલવી, મેનેજર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ ૨૫મો માળ, એ વિંગ, મેરેથોન ક્ચુચરએક્સ, મફતલાલ મિલ્સ કંપાઉન્ડ, એન.એમ.જોશી માર્ગ, લોઅર પરેલ (ઇ), મુંબઇ – ૪૦૦ ૦૧ ૩ ઇ મેઇલ આઈડી -helpdesk.eyoting@cdslindia.com

બોર્ડના હુકમથી ગુજરાત કાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી, આગારમહા : અમદાવાદ સેજલ કણબી તારીખ : ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૫ કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

ફોન નંબર – ૧૮૦૦૨૧૦૯૯૧૧